



ફોરેક્સકાર્ડ - રિલોડ ફોર્મ

પૂરું નામ*શ્રી/સુશ્રી/ડો

કાર્ડનો પ્રકાર:

- ☐ માલ્ટિકરન્સી પ્લોટિંગ ફોરક્સપ્લસ કાઉન્ટ
☐ સિંગલ કરન્સી ફોરક્સપ્લસ રિપ કાઉન્ટ

- હજીજ અને ઉમરાહ કાઠે
રેલાગેયા ફોરેક્સપ્લસ

- | | |
|--|---------------------------|
| | ફોરેક્સપ્લસ કાઉં |
| | આઇએસઆઇસી ફોરેક્સપ્લસ કાઉં |

જારી કરેલા ફોરેક્સની વિગતો

ફોરેક્સ કાર્ડ સંદર્ભ નંબર

[illegible]

પ્રવાસનો ઉદ્દેશ:

ભંડોળના સ્ત્રોત પર નિશાન કરો: પગાર / કારોબાર / કૃષિ / રોકાણ આવક / શૈક્ષણિક લોન / પોતાનું ભંડોળ / અન્ય લોન અથવા ઋણ

નાણાકીય સંસ્થાનું નામ, જ્યાંથી શૈક્ષણિક લોન પ્રાપ્ત કરવામાં આવી હોય:

નિવાસની સ્થિતિ:- નિવાસી ભારતીય- ☐ વ્યક્તિગત ☐ બિન-વ્યક્તિગત / ☐ બિન-નિવાસી ભારતીય (એનઆરઆઇ)
વિદેશી નાગરિક - ☐ પીઆઇઓ/ઓસીઆઇ કાર્ડ ધરાવવું ☐ પીઆઇઓ/ઓસીઆઇ સિવાય અન્ય

રિલોડ કરેલી ચલણોની વિગતો

સર્વોત્તમ સેવા પૂરી પાડતા દેશનું નામ:

ચલણ	એકસીવાય મૂલ્ય	વિનિમય દર	રૂપિયામાં મૂલ્ય*
યુએસડી			
જીબીપી			
એસજીડી			
એયુડી			
ચીએચએફ			
એચકેડી			
એસએઆર			
એનઝેડડી			
એનઓકે			
ફ્યારડબલ્યુ			
બીએચડી			

ચલણ	એકસીવાય મૂલ્ય	વિનિમય દર	રૂપિયામાં મૂલ્ય*
યુરો			
એઇડી			
જીપીવાય			
સીએડી			
એસઇકે			
ટીએચબી			
ઝેડએઆર			
ડીકેકે			
ઓએમઆર			
કેડબ્લ્યુડી			
ક્યુએઆર			
કુલ			

*ભારતીય રૂપિયાની રકમમાં જીએસટી રકમ સામેલ નથી

કૃપા કરીને પાછળના ભાગ પર અધિકૃતતાની નીચે સહી કરો

- હું એચડીએફસી બેંક ડોરેક્સ કાર્ડ જારી કરવા માટે અરજી કરું છું, જેનો અર્થ છે કે હું એવી ધોષણ કરું છું કે અરજીમાં સામેલ માહિતી સાચી અને ખરી છે તથા હું આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્ય કાર્ડ માટે અરજી કરવા પાત્ર છું. જો આ અરજી સ્વીકારવામાં આવે તો હું સમયોચિતરે અમાલી હોઇ શકે અને એચડીએફસી બેંક ડોરેક્સ કાર્ડને નિયંત્રિત કરતા નિયમો શરતો માટે બંધાયેલી રહેશ અને કાર્ડનો ઉપયોગ આ નિયમો અને શરતોનો સ્વીકાર જોઈ હોવાનું માનીવામાં આવશે. હું એચડીએફસી બેંક અને/તેના સહયોગીઓને મારી ઓફિસર/રેહદારો પર કોઇ માહિતીની ખરાબ કરવા માટે અથવા સભ્યતાની આવધવ્યક્તાની પડિય કરવા માટે અથવા ખાતાને સારી શ્રિતિમાં જાળવી રાખવા માટે આવશ્યક હોઇ શકે એવી માહિતી પાત્ર કરવા અથવા પૂરી પાડવા માટે મારો, મારા રોજગારકતા/ બેંકર કેડિટ બ્યુરો/ આરબીઆઇ અથવા અન્ય કોઇ સ્ત્રોત સાથે સંપર્ક કરવા માટે અધિકાર છું. હું સમજું છું અને સ્વીકારું છું કે સ્થાનિક કાયદા અને ભારતીય રિઝર્વ બેંકના નિયમો અને નિયમનો વિરોધી ચલવાનો ખરીદી અને ઉપયોગ માટે ધોરણો અને મર્યાદાઓ નિર્ધારિત કરે છે. હું બાંધપાત્રી આપું છું કે મારા દ્વારા એચડીએફસી બેંક ડોરેક્સ કાર્ડનો ઉપયોગ ભારતીય રિઝર્વ બેંકના વિનિમય નિયંત્રણ નિયમનો અને સમયોચિતરે લાગુ થવા પાત્ર કાયદાઓ, વિશેષ રીતે અને મર્યાદા વિના, વિદેશી વિનિમય સંચાલન ધારા, 1999ને અનુસાર હશે. આમ કરવામાં મારા પહેલે સતી કોઇ નિષ્ફળતાના કિસ્સામાં, મારા દ્વારા આપવામાં આવતી કોઇ માહિતી ખોટી અથવા અયોક્ષક હોવાના કિસ્સામાં હું સમત છું કે હું એચડીએફસી બેંક ડોરેક્સ કાર્ડની ખરીદી અને ઉપયોગને સંચાલિત કરતા સ્થાનિક કાયદા અને/ અથવા નિયમનો, આમ કરી હોઇ શકે છે, તેમના હેઠળ કોઇ/ તમામ હદ અને/ અથવા કાયદાની માટે એક મારા જવાબદાર હોશ.
- હું સમત છું અને સ્વીકારું છું કે એચડીએફસી બેંક મને જારી કરવામાં આવેલા એચડીએફસી બેંક ડોરેક્સ કાર્ડને રિલોડ કરવા માટે કોઇ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી વિનંતીઓ પર કાર્યવાહી કરશે. મારા રોજગારદારની વિનંતી પર મને જારી કરવામાં આવેલા એચડીએફસી બેંક ડોરેક્સ કાર્ડના કિસ્સામાં હું અહીં એચડીએફસી બેંકને એચડીએફસી બેંક ડોરેક્સ કાર્ડને રિલોડ, રદ અને રિફંડ કરવા માટે મારા રોજગારદારના દ્વારા કરેલી વિનંતીઓ પર કાર્યવાહી કરવા અધિકાર છું છું.
- એફડેરીસીઓ/ વિદેશી રદ કાયદા હેઠળ વિનંતો: રદ નિયમનો અનુસાર બેંકને પ્રત્યેક વ્યક્તિના રદ નિયમ અંગે માહિતી એકત્રિત કરવાની જરૂર હોય છે. અમુક સંજોગોમાં (જો બેંક તમારી પાસેથી માન્ય સ્વ-પ્રમાણપત્ર પ્રાપ્ત ન થાય તે સહિત) અમે સંબંધિત રદ સત્તાધિકારીઓની સાથે તમારા ખાતાની માહિતી અપાવે તમારે માટે બંધાયેલી હોઇ શકીએ છીએ. જો તમારા રદ નિયમ અંગે તમને કોઇ પ્રશ્નો હોય તો કૃપા કરીને તમારા વેરાના સલાહકારનો સંપર્ક કરો. જો બેંકને પૂરી પાડેલી માહિતીમાં કોઇ ફેરફાર હોય તો કૃપા કરી સુનિશ્ચિત કરો કે તમે તેની ત્વરિત જાણ અમને 30 દિવસની અંદર કરશો.
- હું સમજું છું અને એકઇએમએ માર્ગદર્શિકા અનુસાર મારો પ્રવાસ પૂર્ણ થયાના 180 દિવસની અંદર કાર્ડ પર 2,000 ડોલર (ડે સમક્ષ) કરતા વધુના મૂલ્યના ઉપયોગમાં નહીં લીધેલા શેષને સરંદર કરવાની જવાબદારી લઉં છું.
- હું સમજું છું કે એવી પરિસ્થિતિ હોઇ શકે છે જ્યારે ડોરેક્સ કાર્ડનો જરૂરી વધુ ઉપયોગ થઈ શકે છે, અને પગલે બેંકને કાર્ડધારકના પક્ષે યુકલ્પી કરતી પડી શકે છે અને કાર્ડમાં નકારાત્મક શેષ થઈ શકે છે. હું સમજું છું અને બેંકને આ નકારાત્મક કાર્ડ શેષને યુકલ્પવા માટેની જવાબદારી લઉં છું, કારણ કે બેંકે મારા દ્વારા ઉપયોગમાં લીધેલા માલ/સેવાઓ માટે આ રકમની યુકલ્પી કરી છે. હું એ પછે સ્વીકારું છું કે બેંક કોઇ પણ પૂર્વ સૂચના આપ્યા વિના મારા ખાતા અથવા બેંક સાથે રહેલા અન્ય બેંક કો પિપેઇઝ ડોરેક્સ કાર્ડમાંથી ઉંબેટ કરીને નકારાત્મક કાર્ડ શેષને નિયમિત કરવાનો અધિકાર ધરાવે છે.

Continued to page 2

ફોરેક્સ કાર્ડ રિલોડ સ્વીકૃત્તિ

ફોરેક્સ સંદર્ભ કાર્ડ નંબર

[illegible]

તારીખ___/___/ 20___ શાખા કોડ:_____

કાર્ડનો પ્રકાર:

- ☐ મલ્ટિકરન્સી પ્લેટિનમ ફોરેક્સપ્લસ કાર્ડ
☐ ફોરેક્સપ્લસ ચિપ કાર્ડ

- ☐ હજીજ અને ઉમરાહ કાર્ડ
 - ☐ રેગાલિયા ફોરેક્સપ્લસ કાર્ડ

- ☐ ફોરેક્સપ્લસ કાર્ડ
☐ આઇએસઆઇસી ફોરેક્સપ્લસ કાર્ડ

લોડ કરેલી ચલણોની વિગતો

ચલણ	અફસોવાય મૂલ્ય	વિનિમય દર	રૂપિયામાં મૂલ્ય*

ચલણ	એફસીવાય મૂલ્ય	વિનિમય દર	રૂપિયામાં મૂલ્ય*
કુલ			

*ભારતીય રૂપિયાની રકમમાં જીએસટી રકમ સામેલ નથી

લોડ કરેલી કુલ રકમ (રૂપિયામાં)

શાખાના સ્ટાફની સહી અને સિક્કો:

- હું સ્વીકારું છું કે બેંકને ખોટો કાર્ડ નંબર જણાવીને ખોટા કાર્ડ નંબરને રિલોડ કરવાનું જોખમ ધરાવું છું. હું સમજું છું કે બેંક તેના માટે જવાબદાર હોઇ શકે નહીં. હું સંમત છું અને સ્વીકારું છું કે ફ્રી રિફંડ થઈ શકતી નથી. હું એચડીએક્સડી બેંકને એવી વિનંતીઓ પર કાર્યવાહી કરવા અધિકૃત કંઈ છું, જે એચડીએક્સડી બેંક મારા દ્વારા અથવા મારા પક્ષે કરવામાં આવેલી હોય એવું માનતી હોય. એચડીએક્સડી બેંક રોકેસ્ટ કાર્ડને રિલોડ કરવાની એવી કોઇ વિનંતીઓને વ્યક્તિગત રીતે મારા દ્વારા કરવામાં આવેલી વિનંતી તરીકે માનવા માટે હકદાર હશે. એચડીએક્સડી બેંક કોઇ પણ રીતે મારી સાથે મૌખિક રીતે અથવા લેખિતમાં અથવા અન્યથા આવી વિનંતીઓ આપવાની પુષ્ટિ કરવા માટે બાધ્ય/આવશ્યક નહીં હોય. હું સમજું છું કે એટીએમ/ઇડીસી ટર્મિનલ્સ મશીન છે અને સંચાલનમાં હોય તે દરમિયાન ત્રુટીઓ હોઇ શકે છે. હું એવા કોઇ પણ મશીન / મિકેનિકલ ત્રુટીઓ/ નિષ્ફળતાઓ માટે બેંકને ક્ષતિપૂર્તિ કરવા સંમત છું.

ચુકવણીનો પ્રકાર (નીચેનામાંથી કોઈ એક માન્ય)

પ્રવર્તમાન એચડીએફસી બેંક ગ્રાહક				નોન એચડીએફસી બેંક ગ્રાહક*			
બેંકનું નામ	એચડીએફસી બેંક			અન્ય બેંકનું નામ			
સહી કરેલો ચેક નંબર (ફરજિયાત)		આઈએફએસસી કોડ		અન્ય બેંકનો સહી કરેલો ચેક નં. (ફરજિયાત)		આઈએફએસસી કોડ	
ખાતા નંબર				બચત ખાતા નંબર (માત્ર)			

(*નોંધ - કાર્ડ સક્રિયતા ક્લિઅરિંગ પછી ભંડોળની ઉપલબ્ધતાને આધિન છે)

ચુકવણીની રકમ (શબ્દોમાં): _____

કાર્ડધારક સાથેનો સંબંધ: ☐ પોતે ☐ પરિવારના સભ્ય (કૃપા કરીને કાર્ડધારક પાસેથી સત્તાધિકારનો પત્ર બિડો (ત્રાહિત પક્ષના કિસ્સામાં))

કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિના સંબંધી હોવાનું માનવામાં આવશે, જો અને માત્ર જો, (1) તેઓ સભ્યો છે અથવા હિન્દુ અવિભાજિત પરિવાર (એચયુએફ) અથવા (2) તેઓ પતિ અને પત્ની છે અથવા (3) વ્યક્તિ નીચે સૂચવેલી રીતે અન્ય સાથે સંબંધ ધરાવે છે:

- | | | | |
|----------------------------|----------------------------|------------------------------|--------------------------------|
| (1) પિતા (સાવકા પિતા સહિત) | (2) માતા (સાવકી માતા સહિત) | (3) પુત્ર (સાવકા પુત્ર સહિત) | (4) પુત્રી (સાવકી પુત્રી સહિત) |
| (5) ભાઈ (સાવકા ભાઈ સહિત) | (6) બહેન (સાવકી બહેન સહિત) | (7) પતિ | (8) પત્ની |

એચડીએફસી બેંકમાં પ્રવર્તમાન બેંક ખાતું ધરાવતા પરિવારના સભ્ય (કાર્ડધારકના પક્ષે ફોરેક્સ કાર્ડમાં ભંડોળ પૂરું પાડવું) પાસેથી ડેબિટ અધિકૃત્તતા:

હું/અમે તમને હસ્તાક્ષર કરેલા ચેક નંબર _____ માંથી મારા/અમારા ખાતા નંબર _____ માંથી ડેબિટ કરવાની અને લાગુ થવા પાત્ર સેવા શુલ્ક અને વેરાની સાથે ઉપરની વિગતો પ્રમાણે ફોરેક્સ કાર્ડમાં ભંડોળ પૂરું પાડવાની અધિકૃત્તતા આપું છું.

ખાતાધારક / પરિવારના સભ્યની સહી X

ખાતાધારક/પરિવારના સભ્યનું નામ:

આવકવેરા ધારા, 1961 હેઠળ ઘોષણા

- ☐ હું પુષ્ટિ કરું છું કે હું આવકવેરા ધારા 1961ની જોગવાઈ અનુસાર નિવાસી વ્યક્તિ છું.
(જો તમે આવકવેરા ધારા 1961 અનુસાર બિન-નિવાસી હોય તો ચેકો મારો, અને વધારાની શીટમાં પ્રવર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતમાં તમારી અંદાજિત વેરાપાત્ર આવક પૂરી પાડો)

250,000 ડોલરની લિબરલાઇઝ્ડ રેમિટન્સ (એલઆરએસ) સ્કિમ હેઠળ વિદેશી ચલણની ખરીદી માટે ઘોષણા

પ્રવર્તમાન નાણાકીય વર્ષ (એપ્રિલ 20____ થી માર્ચ 20____)માં સ્કિમ હેઠળ કરવામાં આવેલા રેમિટન્સ/ થયેલા વ્યવહારોની વિગતો

ક્રમાંક	તારીખ	રકમ	એડી શાખા/ એફએફએમસી, જેના મારફતે વ્યવહાર કરવામાં આવ્યો છે તેનું નામ અને સરનામું.

ક્રમાંક	એલઆરએસ હેઠળ છે કે નહીં (હા/ના)	ઉદ્દેશ કોડ	વર્ણન	ઉદ્દેશ કેટેગરી	ઉદ્દેશ કોડ	ઉદ્દેશ કેટેગરી	ઉદ્દેશ કોડ
				વ્યક્તિગત	S0306	તબીબી સારવાર	S0304
				કારોબાર	S0301	શિક્ષણ	S0305
				રોજગાર	S1307	ઇમિગ્રેશન	S1307

*કૃપા કરીને બહુવિધ રેકૉર્ડ્સના કિસ્સામાં પરિશિષ્ટ ઉમેરો

હું ઘોષણા કરું છું કે -

1) હું/અમે અહીં ઘોષણા કરીએ છીએ કે આ અરજી સહિત નાણાકીય વર્ષ દરમિયાન ભારતમાં તમામ સ્ત્રોતથી ખરીદેલી અથવા તેમના માધ્યમથી રેમિટ કરેલી વિદેશી ચલણની કુલ રકમ ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત 250,000/- યુએસ ડોલર (માત્ર બે લાખ 50 હજાર યુએસ ડોલર)ની એકંદર મર્યાદાની અંદર છે અને પ્રમાણિત કરું છું/કરીએ છીએ કે ઉપરોક્ત રેમિટન્સ માટે ભંડોળનો સ્ત્રોત મારી સાથે સંબંધ ધરાવે છે અને વિદેશી ચલણનો ઉપયોગ પ્રતિબંધિત ઉદ્દેશ માટે કરવામાં નહીં આવે. 2) તમારી પાસેથી ખરીદેલી વિદેશી ચલણ ફોર્મમાં સૂચિત ઉદ્દેશ માટે છે. 3) હું પુષ્ટિ કરું છું કે રેમિટન્સની રકમ વર્ચ્યુઅલ/ કિંચો ચલણોમાં રોકાણ માટે ઉપયોગમાં લેવામાં આવશે નહીં, જે પ્રવર્તમાન નિયમનકારી માર્ગદર્શિકાઓ અનુસાર એલઆરએસ હેઠળ માન્ય મૂડી ખાતા વ્યવહારનો ભાગ નથી.

X

ફોરેક્સ કાર્ડધારકની સહી

નામ: _____

તારીખ: _____

સ્થળ: _____



મહત્વપૂર્ણ નોંધ - ફોરેક્સ કાર્ડ પર આટલું કરો અને આટલું ન કરો

- તમને કાર્ડ પ્રાપ્ત થાય ત્યાર પછી તરત જ તમારા કાર્ડના હસ્તાક્ષર પેનલ પર સહી કરો, જેથી તમે અનધિકૃત વપરાશથી તેને સુરક્ષિત કરી શકો. કાર્ડનો ઉપયોગ માત્ર મર્યદા વેચાણકેન્દ્રો પર કરો અને મર્યદા વેચાણકેન્દ્ર પર કાર્ડથી કરવામાં આવેલા દરેક વ્યવહારના સમયે વેચાણ રસીદ લેવાનું સુનિશ્ચિત કરો. તમારા કાર્ડ માટે નેટબેંકિંગ સુવિધા સક્રિય કરવા માટે કાર્ડ કિટની સાથે પૂરા પાડેલા આઇપિનનો ઉપયોગ કરો.
- કૃપા કરીને મર્યદા સ્થાપત્યો પર એટીએમ/ઇડીસી ટર્મિનલ દ્વારા જનરેટ કરેલા વ્યવહારોનો રેકૉર્ડ તમારી પાસે રાખો. નેટબેંકિંગ આઇડીનાં સેલ્ફ-લોકિંગને રોકવા માટે ઉપયોગ કર્યા પછી તમારા નેટબેંકિંગ ખાતામાંથી લોગાઉટ કરવાનું સુનિશ્ચિત કરો. કાર્ડનો હોટેલ ડિપોઝિટ્સ, કાર રેન્ટલ ડિપોઝિટ્સ વગેરેની ચુકવણી કરવા જેવા હંગામી શુલ્ક માટે ઉપયોગ કરવો જોઇએ નહીં.
- જો તમારું કાર્ડ ખોવાઇ જાય તો કૃપા કરીને તાત્કાલિક ધોરણે ફોન બેંકિંગને કોલ કરીને ખોવાઇ ગયું હોવાની જાણ કરો અથવા પ્રિપેઇડ કાર્ડ નેટબેંકિંગ સુવિધા મારફતે તમારા કાર્ડને બ્લોક કરો.
- ક્યારેય કોઇ પણ વ્યક્તિને તમારા એટીએમ પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર (પિન) અથવા તમારા નેટબેંકિંગ આઇપિન જણાવશો નહીં. કાર્ડ મર્યદા વેચાણકેન્દ્ર પર સમાન વ્યવહાર માટે એક કરતા વધુ વખત સ્વાઇપ થવું જોઇએ નહીં. કૃપા કરીને કાર્ડનો ઉપયોગ એવા મર્યદા વેચાણકેન્દ્રો પર કરશો નહીં, જે કાર્ડ સ્વાઇપ કરતી વખતે તમારા બિલની અધિકૃત્તતા અથવા પતાવટના સમયે ડીસીસી (ડાઇનેમિક કાર્ડની કન્વર્ઝન) વિકલ્પ પસંદ કરતા હોય. કાર્ડનો ઉપયોગ ભારત, નેપાળ અને ભૂતાનમાં ચુકવણીઓ કરવા માટે કરી શકાય નહીં.
- એચડીએફસી બેંક શાખાઓ ખાતે નિયુક્ત બેંક અધિકારીઓ સિવાય કોઇ પણ વ્યક્તિને કાર્ડ ક્યારેય સોંપશો નહીં અને એ પણ મેન્ડેટિડ સ્ટ્રિપ પરથી થોડા ટુકડાઓમાં કાપ્યા પછી સોંપો. મેઇલ ઓર્ડર અને ટેલિફોન ઓર્ડર વ્યવહારો માટે કાર્ડનો ઉપયોગ કરશો નહીં.
- કાર્ડ મર્યદા દ્વારા એડ્રેસ વેરિફિકેશન (એવીએસ) સુવિધાને ટેકો આપતી નથી અને એવીએસ ફરજિયાત હોય એવા મર્યદા વેચાણકેન્દ્રો પર સ્વીકારી શકાય નહીં.

શાખાના ઉપયોગ માટે

- ☐ પુષ્ટિ કરી છે કે પ્રતિબંધિત યાદીની સામે ખરીદદાર માટે ડી-ડ્યુપ્લિકેટ કરવામાં આવી છે. એ પ્રમાણિત કરવામાં આવે છે કે રેમિટન્સ અયોગ્ય સંસ્થાઓ દ્વારા/ને કરવામાં આવી રહ્યું નથી અને રેમિટન્સ સ્કિમ હેઠળ સમયાંતરે રિઝર્વ બેંક દ્વારા જારી કરેલી સૂચનાને અનુરૂપ છે.

શાખાનું નામ _____ શાખા કોડ _____ જારી કર્યાની તારીખ _____ / _____ / 20_____

એલસી કોડ _____

x

એલજી કોડ _____

ઇનપુટરની સહી

એમ્પ્લોઇ નંબર _____

એકત્રિત કરેલા દસ્તાવેજોની યાદી

યુકવણીની રીત માટે: એચડીએફસી બેંક ખાતું

- ☐ સહી કરેલું રિલોડ અરજી ફોર્મ
- ☐ પાસપોર્ટની સ્વપ્રમાણિત કરેલી નકલ
- ☐ હજી રસીદ અને મેનિફેસ્ટ (જો પાસપોર્ટ પૂરો પાડવામાં ન આવ્યો હોય માત્ર તો જ હજી કાર્ડની આવશ્યકતા)
- ☐ પાસેથી કરેલા ફંડિંગ માટેની પુષ્ટિ*
- ☐ નિવાસી બચત ખાતું ☐ એનઆરઇ ખાતું
- ☐ પોતાના ખાતામાંથી થયેલા ફંડિંગ માટેની પુષ્ટિ

યુકવણીની રીત માટે: અન્ય બેંક ખાતું

- ☐ સહી કરેલું રિલોડ અરજી ફોર્મ
- ☐ પાસપોર્ટની સ્વપ્રમાણિત નકલ
- ☐ સરનામાનો પુરાવો (જો સરનામું પાસપોર્ટમાં ઉલ્લેખ કરેલા સરનામાંથી અલગ હોય તો)
- ☐ ભરતી પત્ર / પ્રવેશ પત્ર / યુનિવર્સિટી ઓળખપત્ર (માત્ર આઇએસઆઇસી કાર્ડ માટે આવશ્યક)ની સ્વપ્રમાણિત નકલ
- ☐ હજી રસીદ અને મેનિફેસ્ટ (જો પાસપોર્ટ પૂરો પાડવામાં ન આવ્યો હોય માત્ર તો જ હજી કાર્ડની આવશ્યકતા)
- ☐ અન્ય બેંક સ્ટેટમેન્ટ (1 વર્ષ)/ પાસબુકની સ્વપ્રમાણિત કરેલી નકલ અથવા ખાતાના પ્રકારની પુષ્ટિ કરતા/જણાવતા કેન્સલ્ડ ચેક
- ☐ પાસેથી કરેલા ફંડિંગ માટેની પુષ્ટિ*
- ☐ નિવાસી બચત ખાતું
- ☐ પોતાના ખાતામાંથી થયેલા ફંડિંગ માટેની પુષ્ટિ

*શાખા ફંડિંગ માન્ય કરશે ખાતા પ્રકાર (માત્ર બચત ખાતું હશે) આધારે અન્ય બેંક સ્ટેટમેન્ટ/પાસબુક/કેન્સલ્ડ ચેક